

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૪/૧૨/૨૦૧૭ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૪૩૪/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૨ કેસ કરી, ૪૦ વ્યક્તિઓને ઝડપી, ૧૪૫ લીટર દેશી દારૂ, ૧૫ બોટલ ઇંગ્લીશ દારૂ, ૫૦૦ ક્વોટર ઇંગ્લીશ દારૂ ૦૧ સ્કુટર અને ૦૧ કાર કબજે કરી હતી. તેમજ જુગારધારા હેઠળ ૦૩ કેસ કરી ૦૯ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૬૧,૭૯૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૪૩૫/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૮૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૩૨ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૨૪૩૬/૧૭

સોલા હાઇકોર્ટ : ઓમના તે રાજન ચિન્નપન મનકલ્લ ની વિધવા પત્ની (ઉ.વ.૬૬) (રહે,શુકન ગોલ્ડ વંદેમાતરમ આર્કેડ પાસે ચાંદલોડીયા) એ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૩/૧૨/૧૭ ના કલાક ૯/૧૦ વાગ્યાના સુમારે ગોતા, વંદેમાતરમ આર્કેડ પાસે રોડ ઉપર ત્રણ અજાણ્યા ઇસમો (૩૦ થી ૪૦ વર્ષ આશરના) એ ભેગામળી અમીનાબેનને "અહિ ચેકિંગ ચાલે છે" તેમ કહી વિશ્વાસમાં લઈ, તેઓએ પહેરેલ સોનાની ચેઇન કિંમત રૂપિયા ૭૦,૦૦૦/- તથા સોનાની બંગડી નંગ-૩ કિંમત રૂપિયા ૪૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૧૫,૦૦૦/- મતાના દાગીના અમીનાબેન પાસેથી ઉતરાવી પેપરના પડીકા માં બાંધી અમીનાબેનની નજર ચુકવી પેપરવાળુ પડીકુ પિત્તળની બંગડીઓ વાળા પડીકા સાથે બદલી દઈ, મોટર સાયકલ ઉપર નાસી જઈ, ઓમનાબેન સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યા છે.આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.આર.મેઘાણી ચલાવે છે.

ઘરફોડ ચોરી :-

સમાચાર યાદી નં.૨૪૩૭/૧૭

વાસણા : અર્જુનકુમાર રામનારાયણ તનેજા (ઉ.વ.૬૦)(રહે,ઇન્દ્રપ્રસ્થ રો-હાઉસ, પ્રથમા બ્લડ બેંકની પાસે વાસણા) એ તા.૦૩/૧૨/૧૭ નારોજ વાસણા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૫/૧૧/૧૭ રાતના ૦૦/૦૦ થી તા.૦૩/૧૨/૧૭ ના કલાક ૦૭/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના મુખ્ય દરવાજા નો નકુચો તોડી અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કરી, તીજોરી તથા કબાટમા રાખેલ રોકડા રૂપિયા ૭૦,૦૦૦/- ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.એચ.જાડેજા ચલાવે છે.

અમરાઇવાડી : હિતેન્દ્રસિંહ અમરસિંહ ચાવડા (ઉ.વ.૩૬)(રહે,અમરકુંજ, બળીયાવાસ બહુચર માતાના મંદીર સામે અમરાઇવાડી ગામ) એ અમરાઇવાડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩/૧૨/૧૭ બપોરના ૨/૦૦ થી ૨/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના મુખ્ય દરવાજા નો નકુચો તોડી, અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કરી, તીજોરીમાંથી સોના ના દાગીના કિંમત રૂપિયા ૩૦,૦૦૦/-, એક સેમસંગ મોબાઇલ કિંમત રૂપિયા ૧,૦૦૦/- અને રોકડ રૂપિયા ૮૩,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૧૪,૦૦૦/- મતાની ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એમ.તેજોત ચલાવે છે.

સોનાનો દોરો ખેંચી તોડી લઇ ગયા :-

સમાચાર યાદી નં.૨૪૩૮/૧૭

શહેરકોટડા : ભાનુભાઇ હીરાભાઇ પટેલ (ઉ.વ.૬૪)(રહે,ન્યુ પંચવટી એપાર્ટમેન્ટ S.K.કોમ્પ્લેક્સની પાછળ, ઇન્ડીયા કોલોની બાપુનગર) તા.૦૨/૧૨/૧૭ સાંજના ૬/૦૦ થી ૬/૧૫ વાગ્યા દરમ્યાન પોતાની પત્ની નયનાબેનને મોટર સાયકલ ઉપર પાછળ બેસાડી પસાર થઇ રહ્યા હતા દરમ્યાન અમદ્રુપુરા વોરાના રોજા રોડ ઉપર વળાંકનજીક એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરુષ(૨૫ થી ૩૫ વર્ષના આશરના) નયનાબેનનાં ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ખેંચી તોડી લઇ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ નયનાબેનનાં પતિ ભાનુભાઇ પટેલે શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.ડી.ચાવડા ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૨૪૩૯/૧૭

ઓઢવ : ઇલાબેન શૈલેષભાઇ ખાંટ (ઉ.વ.૨૩)(રહે,સિંગરવા ગામ, સાગર કેમીકલ પાસે, ચોસમીયા રોડ ખેતરમાં, ઓઢવ) એ પતિ એ પિયર માં જવાની ના પાડતા, મનમાં લાગી આવતા તા.૦૩/૧૨/૧૭ સવારના ૮/૦૦ વાગ્યાનાં સુમારે પોતાના ઘરે ખેતીકામ માં વપરાતી ઇયળ મારવાની દવા પી ગયેલ હોઇ, સારવાર અર્થે તેમને ઓઢવ સી.યુ.એચ.હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન બપોરનાં ૩/૦૦ વાગે ફરજ પરના ડો.શ્રી એ ઇલાબેનને મૃતજાહેર કર્યા હતા. આ અંગે ઓઢવ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી પી.કે.જાદવ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.